



The Summary of Benefits and Coverage (SBC) document will help you choose a health [plan](#). The SBC shows you how you and the [plan](#) would share the cost for covered health care services. **NOTE: Information about the cost of this [plan](#) (called the [premium](#)) will be provided separately. This is only a summary.** For general definitions of common terms, such as [allowed amount](#), [balance billing](#), [coinsurance](#), [copayment](#), [deductible](#), [provider](#), or other underlined terms see the Glossary. You can view the Glossary at [www.healthcare.gov/sbc-glossary/](http://www.healthcare.gov/sbc-glossary/) or call 833-831-0085 to request a copy.

**Health Reimbursement Account (HRA) Contribution: \$500 Individual/\$1,000 Family** for In Network and Out of Network providers. Contributions will be pro-rated based on effective date of health insurance benefits.

| Important Questions                                                                                      | Answers                                                                                                                                                          | Why This Matters:                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |
|----------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| What is the overall Calendar Year <a href="#">deductible</a> ?                                           | \$2,000/member or \$4,000/family for In- <a href="#">Network Providers</a> and Out-of- <a href="#">Network Providers</a> <a href="#">combined</a> .              | Generally you must pay all of the costs from <a href="#">providers</a> up to the <a href="#">deductible</a> amount before this <a href="#">plan</a> begins to pay. If you have other family members on the <a href="#">plan</a> , each family member must meet their own individual <a href="#">deductible</a> until the total amount of <a href="#">deductible</a> expenses paid by all family members meets the overall family <a href="#">deductible</a> .                                                                                                                                     |
| Are there services covered before you meet your <a href="#">deductible</a> ?                             | Yes. In-Network <a href="#">Preventive care</a> and annual Vision exam for In- <a href="#">Network Providers</a> .                                               | This <a href="#">plan</a> covers some items and services even if you haven't yet met the <a href="#">deductible</a> amount. But a <a href="#">copayment</a> or <a href="#">coinsurance</a> may apply. For example, this <a href="#">plan</a> covers certain <a href="#">preventive services</a> without <a href="#">cost-sharing</a> and before you meet your <a href="#">deductible</a> . See a list of covered <a href="#">preventive services</a> at <a href="https://www.healthcare.gov/coverage/preventive-care-benefits">https://www.healthcare.gov/coverage/preventive-care-benefits</a> . |
| Are there other <a href="#">deductibles</a> for specific services?                                       | No.                                                                                                                                                              | You don't have to meet <a href="#">deductibles</a> for specific services.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |
| What is the Medical and Prescription <a href="#">out-of-pocket limit</a> for this <a href="#">plan</a> ? | \$3,500/ member or \$7,000/family for In- <a href="#">Network Providers</a> . \$6,500/ member or \$13,000/family for Out-of- <a href="#">Network Providers</a> . | The Medical and prescription <a href="#">out-of-pocket limit</a> is the most you could pay in a year for covered services. If you have other family members in this <a href="#">plan</a> , they have to meet their own <a href="#">out-of-pocket limits</a> until the overall family <a href="#">out-of-pocket limit</a> has been met.                                                                                                                                                                                                                                                            |
| What is not included in the <a href="#">out-of-pocket limit</a> ?                                        | Cost share of routine vision care, <a href="#">Premiums</a> , <a href="#">Balanced-Billed</a> charges, and Health Care this <a href="#">plan</a> doesn't cover.  | Even though you pay these expenses, they don't count toward the <a href="#">out-of-pocket limit</a> .                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             |

|                                                                                           |                                                                                                                                              |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            |
|-------------------------------------------------------------------------------------------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <p><b>Will you pay less if you use a <a href="#">network provider</a>?</b></p>            | <p>Yes, KeyCare PPO. See <a href="http://www.anthem.com">www.anthem.com</a> or call 833-831-0085 for a list of <b>Network Providers</b>.</p> | <p>This <a href="#">plan</a> uses a <a href="#">provider network</a>. You will pay less if you use a <a href="#">provider</a> in the <a href="#">plan's network</a>. You will pay the most if you use an <a href="#">out-of-network provider</a>, and you might receive a bill from a <a href="#">provider</a> for the difference between the <a href="#">provider's</a> charge and what your <a href="#">plan</a> pays (<a href="#">balance billing</a>). Be aware your <a href="#">network provider</a> might use an <a href="#">out-of-network provider</a> for some services (such as lab work). Check with your <a href="#">provider</a> before you get services.</p> |
| <p><b>Do you need a <a href="#">referral</a> to see a <a href="#">specialist</a>?</b></p> | <p>No.</p>                                                                                                                                   | <p>You can see the <a href="#">specialist</a> you choose without a <a href="#">referral</a>.</p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           |

 All [coinsurance](#) costs shown in this chart are after your [deductible](#) has been met.

| Common Medical Event                                                   | Services You May Need                                            | What You Will Pay                            |                                                 | Limitations, Exceptions, & Other Important Information                                                                                                                    |
|------------------------------------------------------------------------|------------------------------------------------------------------|----------------------------------------------|-------------------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|                                                                        |                                                                  | In-Network Provider (You will pay the least) | Out-of-Network Provider (You will pay the most) |                                                                                                                                                                           |
| If you visit a health care <a href="#">provider's office</a> or clinic | <a href="#">Primary care</a> visit to treat an injury or illness | 20% <a href="#">coinsurance</a>              | 40% <a href="#">coinsurance</a>                 | Virtual visits (Telehealth) benefits available.                                                                                                                           |
|                                                                        | <a href="#">Specialist</a> visit                                 | 20% <a href="#">coinsurance</a>              | 40% <a href="#">coinsurance</a>                 | Virtual visits (Telehealth) benefits available.                                                                                                                           |
|                                                                        | <a href="#">Preventive care/screening</a> /immunization          | No cost share                                | 40% <a href="#">coinsurance</a>                 | You may have to pay for services that aren't preventive. Ask your <a href="#">provider</a> if the services you need are preventive. Travel immunizations are not covered. |
| If you have a test                                                     | <a href="#">Diagnostic test</a> (x-ray, blood work)              | 20% <a href="#">coinsurance</a>              | 40% <a href="#">coinsurance</a>                 | -----none-----                                                                                                                                                            |
|                                                                        | Imaging (CT/PET scans, MRIs)                                     | 20% <a href="#">coinsurance</a>              | 40% <a href="#">coinsurance</a>                 | Preauthorization required                                                                                                                                                 |

| Common Medical Event                                                                                                                                                                                                                                                                                                                                                                                            | Services You May Need                            | What You Will Pay                                                                        |                                                    | Limitations, Exceptions, & Other Important Information                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           |
|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------|------------------------------------------------------------------------------------------|----------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |                                                  | In-Network Provider<br>(You will pay the least)                                          | Out-of-Network Provider<br>(You will pay the most) |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |
| <p><b>If you need drugs to treat your illness or condition</b><br/>More information about <a href="http://www.anthem.com/pharmacyinformation">prescription drug coverage</a> is available at <a href="http://www.anthem.com/pharmacyinformation">http://www.anthem.com/pharmacyinformation</a></p> <p><b>Base Network</b></p> <p><b>National Direct Plus formulary</b></p> <p><b>Optional Home Delivery</b></p> | Tier 1                                           | After deductible,<br>Retail Co-pay - \$15<br>Mail Order Co-pay - \$37.50 Co-pay          | N/A                                                | <p>Retail pharmacy drugs are limited to up to a 30-day or up to a 90- day supply of maintenance medications. You pay additional copays for retail fills that exceed 30 days. Home delivery drugs are limited to up to a 90-day day supply per fill.</p> <p>*If you visit an out-of-network pharmacy, you will pay the full cost of your prescription at the pharmacy and then file a claim for reimbursement. <u>Reimbursement will be based on what a participating pharmacy would receive had the prescription been filled at a participating pharmacy.</u></p> <p>Your plan uses a preferred drug list (formulary) which identifies the status of covered drugs. Some drugs may require preauthorization, while other drugs are subject to step therapy and quantity limit requirements. If the necessary preauthorization is not obtained, the drug may not be covered.</p> <p>Cap on insulin at \$50 for a 30 day supply and \$150 for a 90 day supply.</p> |
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | Tier 2                                           | After deductible,<br>Retail Co-Pay \$40<br>Mail Order Co-Pay \$100                       | N/A                                                |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | Tier 3                                           | After deductible,<br>Retail Co-Pay \$75<br>Mail Order Co-Pay \$187.50                    | N/A                                                |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | Tier 4                                           | After deductible,<br>CarelonRx Specialty Pharmacy: 20% coinsurance up to a \$200 maximum | N/A                                                |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |
| <p><b>If you have outpatient surgery</b></p>                                                                                                                                                                                                                                                                                                                                                                    | Facility fee (e.g., ambulatory surgery center)   | 20% <a href="#">coinsurance</a>                                                          | 40% <a href="#">coinsurance</a>                    | -----none-----                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | Physician/surgeon fees                           | 20% <a href="#">coinsurance</a>                                                          | 40% <a href="#">coinsurance</a>                    | -----none-----                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| <p><b>If you need immediate medical attention</b></p>                                                                                                                                                                                                                                                                                                                                                           | <a href="#">Emergency room care</a>              | 20% <a href="#">coinsurance</a>                                                          | Covered as In-<br><a href="#">Network</a>          | -----none-----                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | <a href="#">Emergency medical transportation</a> | 20% <a href="#">coinsurance</a>                                                          | Covered as In-<br><a href="#">Network</a>          | Air ambulance subject to medical necessity                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       |

| Common Medical Event                                                   | Services You May Need                                  | What You Will Pay                               |                                                    | Limitations, Exceptions, & Other Important Information                                                                                                                               |
|------------------------------------------------------------------------|--------------------------------------------------------|-------------------------------------------------|----------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|                                                                        |                                                        | In-Network Provider<br>(You will pay the least) | Out-of-Network Provider<br>(You will pay the most) |                                                                                                                                                                                      |
|                                                                        | <a href="#"><u>Urgent care</u></a>                     | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | -----none-----                                                                                                                                                                       |
| If you have a hospital stay                                            | Facility fee (e.g., hospital room)                     | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | Precertification required.                                                                                                                                                           |
|                                                                        | Physician/surgeon fee                                  | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | -----none-----                                                                                                                                                                       |
| If you need mental health, behavioral health, or substance abuse needs | Outpatient services                                    | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | -----none-----                                                                                                                                                                       |
|                                                                        | Inpatient services                                     | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | Precertification required.                                                                                                                                                           |
| If you are pregnant                                                    | Office visits                                          | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | -----none-----                                                                                                                                                                       |
|                                                                        | Childbirth/delivery professional services (OB-Gyn Dr.) | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             |                                                                                                                                                                                      |
|                                                                        | Childbirth/delivery facility services                  | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             |                                                                                                                                                                                      |
| If you need help recovering or have other special health needs         | <a href="#"><u>Home health care</u></a>                | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | 100 visit maximum/per calendar year.                                                                                                                                                 |
|                                                                        | <a href="#"><u>Rehabilitation services</u></a>         | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | There is a 30-visit limit for physical and occupational therapy, combined. 30-visit limit for speech therapy. Early Intervention Services Pre-determination of eligibility required. |
|                                                                        | <a href="#"><u>Habilitation services</u></a>           | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             |                                                                                                                                                                                      |
|                                                                        | <a href="#"><u>Skilled nursing care</u></a>            | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | 100 day per stay limit; pre-authorization required.                                                                                                                                  |
|                                                                        | <a href="#"><u>Durable medical equipment</u></a>       | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | -----none-----                                                                                                                                                                       |
|                                                                        | <a href="#"><u>Hospice service</u></a>                 | 20% <a href="#"><u>coinsurance</u></a>          | 40% <a href="#"><u>coinsurance</u></a>             | -----none-----                                                                                                                                                                       |

| Common Medical Event                          | Services You May Need      | What You Will Pay                               |                                                    | Limitations, Exceptions, & Other Important Information |
|-----------------------------------------------|----------------------------|-------------------------------------------------|----------------------------------------------------|--------------------------------------------------------|
|                                               |                            | In-Network Provider<br>(You will pay the least) | Out-of-Network Provider<br>(You will pay the most) |                                                        |
| <b>If your child needs dental or eye care</b> | Children's eye exam        | \$15 copay/ visit                               | \$30 allowance/visit                               | One routine exam per calendar year.                    |
|                                               | Children's glasses         | Not covered                                     | Not covered                                        | -----none-----                                         |
|                                               | Children's dental check-up | Not covered                                     | Not covered                                        | -----none-----                                         |

**Excluded Services & Other Covered Services:**

**Services Your [Plan](#) Does NOT Cover (This isn't a complete list. Check your policy or plan document for other [excluded services](#).)**

|                                                      |                                                               |                      |
|------------------------------------------------------|---------------------------------------------------------------|----------------------|
| Bariatric Surgery<br>Cosmetic surgery<br>Dental care | Adult Hearing aids<br>Infertility treatment<br>Long term care | Weight loss programs |
|------------------------------------------------------|---------------------------------------------------------------|----------------------|

**Other Covered Services (Limitations may apply to these services. This isn't a complete list. Please see your [plan](#) document.)**

|                                                                                  |                                                                                                                                                                                                                                                   |                                                          |
|----------------------------------------------------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------------------------------------------------------|
| Autism Spectrum Disorder<br>Chiropractor care<br>Routine eye care<br>Acupuncture | Coverage provided outside the United States. See <a href="http://www.bcbs.com/bluecardworldwide">www.bcbs.com/bluecardworldwide</a><br><br>Hearing aid coverage for age 18 and younger – \$1,500 maximum per hearing impaired ear every 36 months | Home Private-duty nursing 16 hours/member/benefit period |
|----------------------------------------------------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------------------------------------------------------|

**Your Rights to Continue Coverage:** There are agencies that can help if you want to continue your coverage after it ends. The contact information for those agencies is: Department of Labor's Employee Benefits Security Administration at 1-866-444-EBSA (3272) or [www.dol.gov/ebsa/healthreform](http://www.dol.gov/ebsa/healthreform). Other coverage options may be available to you too, including buying individual insurance coverage through the Health Insurance **Marketplace**. For more information about the **Marketplace**, visit [www.HealthCare.gov](http://www.HealthCare.gov) or call 1-800-318-2596.

**Your Grievance and Appeals Rights:** There are agencies that can help if you have a complaint against your **plan** for a denial of a **claim**. This complaint is called a **grievance** or **appeal**. For more information about your rights, look at the explanation of benefits you will receive for that medical **claim**. Your **plan** documents also provide complete information to submit a **claim**, **appeal**, or a **grievance** for any reason to your **plan**. For more information about your rights, this notice, or assistance, contact:

ATTN: Grievances and Appeals, P.O. Box 27401, Richmond, VA 23279

Department of Labor, Employee Benefits Security Administration, (866) 444-EBSA (3272), [www.dol.gov/ebsa/healthreform](http://www.dol.gov/ebsa/healthreform)

Virginia Bureau of Insurance, 1300 East Main Street, P. O. Box 1157, Richmond, VA 23218, (800) 552-7945

**Does this plan provide Minimum Essential Coverage? Yes**

**Minimum Essential Coverage** generally includes **plans**, **health insurance** available through the **Marketplace** or other individual market policies, Medicare, Medicaid, CHIP, TRICARE, and certain other coverage. If you are eligible for certain types of **Minimum Essential Coverage**, you may not be eligible for the **premium tax credit**.

**Does this plan meet the Minimum Value Standards? Yes**

If your **plan** doesn't meet the **Minimum Value Standards**, you may be eligible for a **premium tax credit** to help you pay for a **plan** through the **Marketplace**.

—————*To see examples of how this plan might cover costs for a sample medical situation, see the next section.*—————

## About these Coverage Examples:



**This is not a cost estimator.** Treatments shown are just examples of how this [plan](#) might cover medical care. Your actual costs will be different depending on the actual care you receive, the prices your [providers](#) charge, and many other factors. Focus on the [cost sharing](#) amounts ([deductibles](#), [copayments](#) and [coinsurance](#)) and [excluded services](#) under the [plan](#). Use this information to compare the portion of costs you might pay under different health [plans](#). Please note these coverage examples are based on self-only coverage.

### Peg is Having a Baby (9 months of in-network pre-natal care and a hospital delivery)

- The [plan's](#) overall [deductible](#) \$2,000
- [Specialist coinsurance](#) 20%
- Hospital (facility) [coinsurance](#) 20%
- Other [coinsurance](#) 20%

This EXAMPLE event includes services like:

[Specialist](#) office visits (*prenatal care*)  
 Childbirth/Delivery Professional Services  
 Childbirth/Delivery Facility Services  
[Diagnostic tests](#) (*ultrasounds and blood work*)  
[Specialist visit](#) (*anesthesia*)

|                    |          |
|--------------------|----------|
| Total Example Cost | \$12,840 |
|--------------------|----------|

In this example, Peg would pay:

| <a href="#">Cost Sharing</a>      |                |
|-----------------------------------|----------------|
| <a href="#">Deductibles</a>       | \$2,000        |
| <a href="#">Copayments</a>        | \$0            |
| <a href="#">Coinsurance</a>       | \$1,500*       |
| <i>What isn't covered</i>         |                |
| Limits or exclusions              | \$0            |
| <b>The total Peg would pay is</b> | <b>\$3,500</b> |

The coinsurance would have been \$2,168, but was capped at \$1,500 due to \$3,500 OOP max.

### Managing Joe's type 2 Diabetes (a year of routine in-network care of a well-controlled condition)

- The [plan's](#) overall [deductible](#) \$2,000
- [Primary Care coinsurance](#) 20%
- Hospital (facility) [coinsurance](#) 20%
- Other [coinsurance](#) 20%

This EXAMPLE event includes services like:

[Primary care physician](#) office visits (*including disease education*)  
[Diagnostic tests](#) (*blood work*)  
[Prescription drugs](#)  
[Durable medical equipment](#) (*glucose meter*)

|                    |         |
|--------------------|---------|
| Total Example Cost | \$7,460 |
|--------------------|---------|

In this example, Joe would pay:

| <a href="#">Cost Sharing</a>      |                |
|-----------------------------------|----------------|
| <a href="#">Deductibles</a>       | \$1,000        |
| <a href="#">Copayments</a>        | \$0            |
| <a href="#">Coinsurance</a>       | \$1,292        |
| <i>What isn't covered</i>         |                |
| Limits or exclusions              | \$0            |
| <b>The total Joe would pay is</b> | <b>\$2,292</b> |

Joe's Diabetic drugs are on the PreventiveRx Plus drug list and not subject to the deductible

### Mia's Simple Fracture (in-network emergency room visit and follow up care)

- The [plan's](#) overall [deductible](#) \$2,000
- [Specialist coinsurance](#) 20%
- Hospital (facility) [coinsurance](#) 20%
- Other [coinsurance](#) 20%

This EXAMPLE event includes services like:

[Emergency room care](#) (*including medical supplies*)  
[Diagnostic test](#) (*x-ray*)  
[Durable medical equipment](#) (*crutches*)  
[Rehabilitation services](#) (*physical therapy*)

|                    |         |
|--------------------|---------|
| Total Example Cost | \$2,010 |
|--------------------|---------|

In this example, Mia would pay:

| <a href="#">Cost Sharing</a>      |                |
|-----------------------------------|----------------|
| <a href="#">Deductibles</a>       | \$2,000        |
| <a href="#">Copayments</a>        | \$0            |
| <a href="#">Coinsurance</a>       | \$2            |
| <i>What isn't covered</i>         |                |
| Limits or exclusions              | \$0            |
| <b>The total Mia would pay is</b> | <b>\$2,002</b> |

## Language Access Services:

(TTY/TDD: 711)

**Albanian (Shqip):** Nëse keni pyetje në lidhje me këtë dokument, keni të drejtë të merrni falas ndihmë dhe informacion në gjuhën tuaj. Për të kontaktuar me një përkthyes, telefononi 833-831-0085

**Amharic (አማርኛ):-** ስለዚህ ሰነድ ማንኛውም ጥያቄ ካለዎት በራስዎ ቋንቋ እርዳታ እና ይህን መረጃ በነጻ የማግኘት መብት አለዎት። አስተርጓሚ ለማናገር 833-831-0085 ይደውሉ።

Arabic (العربية): إذا كان لديك أي استفسارات بشأن هذا المستند، فيحق لك الحصول على المساعدة والمعلومات بلغتك دون مقابل. للتحدث إلى مترجم، اتصل على 833-831-0085.

**Armenian (հայերեն).** Եթե այս փաստաթղթի հետ կապված հարցեր ունեք, դուք իրավունք ունեք անվճար ստանալ օգնություն և տեղեկատվություն ձեր լեզվով: Թարգմանչի հետ խոսելու համար զանգահարեք հետևյալ հեռախոսահամարով՝ 833-831-0085:

**Bassa (Bàsɔ̀ Wùdù):** M̄ dyi dyi-diè-djè b̄é b̄édjé b̄á céè-djè nià ke dyí ní, ɔ̀ m̀ò̀ nì dyí-b̄édjèin-djè b̄é m̄ k̄é gbo-kpá-kpá kè b̄ǎ̀ kpǎ̀ djé m̄ bídí-wùdùün b̄ó pídyi. B̄é m̄ k̄é wuɖu-zìin-nyò djò gbo wùdù ke, djá 833-831-0085.

**Bengali (বাংলা):** যদি এই তথ্য পুস্তিকার বিষয়ে আপনার কোনো প্রশ্ন থাকে, তাহলে আপনার ভাষায় বিনামূল্যে সাহায্য পাওয়ার ও তথ্য পাওয়ার অধিকার আপনার আছে। একজন দোভাষীর সাথে কথা বলার জন্য কল করুন 833-831-0085

**Burmese (မြန်မာ):** ဤစာရွက်စာတမ်းနှင့် ပတ်သက်၍ သင့်တွင် မေးမြန်းလိုသည်များရှိပါက အချက်အလက်များနှင့် အကူအညီကို အခကြေးငွေ ပေးစရာမလိုပဲ သင့်ဘာသာစကားဖြင့် ရယူနိုင်ခွင့် သင့်တွင် ရှိပါသည်။ စကားပြန် တစ်ဦးနှင့် စကားပြောနိုင်ရန် ဖုန်း 833-831-0085 သို့ ခေါ်ဆိုပါ။

**Chinese (中文):** 如果您對本文件有任何疑問，您有權使用您的語言免費獲得協助和資訊。如需與譯員通話，請致電 833-831-0085。

**Dinka (Dinka):** Na nɔŋ thiëc në ke de yā thorë, ke yin nɔŋ loŋ bē yi kuony ku wër alëu bē gɛɛr yic yin ne thoŋ du ke cin wëu tāäuë ke piny. Te kør yin ba jam wënë ran ye thok geryic, ke yin col 833-831-0085.

**Dutch (Nederlands):** Bij vragen over dit document hebt u recht op hulp en informatie in uw taal zonder bijkomende kosten. Als u een tolk wilt spreken, belt u 833-831-0085.

**Farsi (فارسي):** در صورتی که سؤالی پیرامون این سند دارید، این حق را دارید که اطلاعات و کمک را بدون هیچ هزینه‌ای به زبان مادری‌تان دریافت کنید. برای گفتگو با یک مترجم شفاهی، با شماره 833-831-0085 تماس بگیرید.



## Language Access Services:

**French (Français) :** Si vous avez des questions sur ce document, vous avez la possibilité d'accéder gratuitement à ces informations et à une aide dans votre langue. Pour parler à un interprète, appelez le 833-831-0085.

**German (Deutsch):** Wenn Sie Fragen zu diesem Dokument haben, haben Sie Anspruch auf kostenfreie Hilfe und Information in Ihrer Sprache. Um mit einem Dolmetscher zu sprechen, bitte wählen Sie 833-831-0085.

**Greek (Ελληνικά)** Αν έχετε τυχόν απορίες σχετικά με το παρόν έγγραφο, έχετε το δικαίωμα να λάβετε βοήθεια και πληροφορίες στη γλώσσα σας δωρεάν. Για να μιλήσετε με κάποιον διερμηνέα, τηλεφωνήστε στο 833-831-0085.

**Gujarati (ગુજરાતી):** જો આ દસ્તાવેજ અંગે આપને કોઈપણ પ્રશ્નો હોય તો, કોઈપણ ખર્ચ વગર આપની ભાષામાં મદદ અને માહિતી મેળવવાનો તમને અધિકાર છે. દુભાષિયા સાથે વાત કરવા માટે, કોલ કરો 833-831-0085.

**Haitian Creole (Kreyòl Ayisyen):** Si ou gen nenpòt kesyon sou dokiman sa a, ou gen dwa pou jwenn èd ak enfòmasyon nan lang ou gratis. Pou pale ak yon entèprete, rele 833-831-0085.

**Hindi (हिंदी):** अगर आपके पास इस दस्तावेज़ के बारे में कोई प्रश्न हैं, तो आपको निःशुल्क अपनी भाषा में मदद और जानकारी प्राप्त करने का अधिकार है। दुभाषिये से बात करने के लिए, कॉल करें 833-831-0085 ।

**Hmong (White Hmong):** Yog tias koj muaj lus nug dab tsi ntsig txog daim ntawv no, koj muaj cai tau txais kev pab thiab lus qhia hais ua koj hom lus yam tsim xam tus nqi. Txhawm rau tham nrog tus neeg txhais lus, hu xov tooj rau 833-831-0085.

**Igbo (Igbo):** Ọ bụr ụ na ị nwere ajujụ ọ bụla gbasara akwụkwọ a, ị nwere ikike ịnweta enyemaka na ozi n'asụsụ gị na akwụghị ụgwọ ọ bụla. Ka gị na ọkọwa okwu kwuo okwu, kpọọ 833-831-0085.

**Ilokano (Ilokano):** Nu addaan ka iti aniaman a saludsod panggep iti daytoy a dokumento, adda karbengam a makaala ti tulong ken impormasyon babaen ti lenguahem nga awan ti bayad na. Tapno makatungtong ti maysa nga tagipatarus, awagan ti 833-831-0085.

**Indonesian (Bahasa Indonesia):** Jika Anda memiliki pertanyaan mengenai dokumen ini, Anda memiliki hak untuk mendapatkan bantuan dan informasi dalam bahasa Anda tanpa biaya. Untuk berbicara dengan interpreter kami, hubungi 833-831-0085.

## Language Access Services:

**Italian (Italiano):** In caso di eventuali domande sul presente documento, ha il diritto di ricevere assistenza e informazioni nella sua lingua senza alcun costo aggiuntivo. Per parlare con un interprete, chiami il numero 833-831-0085

**Japanese (日本語):** この文書についてなにかご不明な点があれば、あなたにはあなたの言語で無料で支援を受け情報を得る権利があります。通訳と話すには、833-831-0085 にお電話ください。

**Khmer (ខ្មែរ):** បើអ្នកមានសំណួរផ្សេងទៀតអំពីឯកសារនេះ អ្នកមានសិទ្ធិទទួលជំនួយនិងព័ត៌មានជាភាសារបស់អ្នកដោយឥតគិតថ្លៃ។ ដើម្បីជជែកជាមួយអ្នកបកប្រែ សូមហៅ 833-831-0085 ។

**Kirundi (Kirundi):** Ugize ikibazo ico arico cose kuri iyi nyandiko, ufise uburenganzira bwo kuronka ubufasha mu rurimi rwawe ata giciro. Kugira uvugishe umusemuzi, akura 833-831-0085.

**Korean (한국어):** 본 문서에 대해 어떠한 문의사항이라도 있을 경우, 귀하에게는 귀하가 사용하는 언어로 무료 도움 및 정보를 얻을 권리가 있습니다. 통역사와 이야기하려면 833-831-0085로 문의하십시오.

**Lao (ພາສາລາວ):** ຖ້າທ່ານມີຄໍາຖາມໃດໆກ່ຽວກັບເອກະສານນີ້, ທ່ານມີສິດໄດ້ຮັບຄວາມຊ່ວຍເຫຼືອ ແລະ ຂໍ້ມູນເປັນພາສາຂອງທ່ານໂດຍບໍ່ເສຍຄ່າ. ເພື່ອໂອ້ນລັກກັບວ່າມແບພາສາ, ໃຫ້ໂທຫາ 833-831-0085.

**Navajo (Diné):** Dii naaltsoos biká'ígíí lahgo bina'idiilkidgo ná bohónéedzá dóó bee ahóót'i' t'áá ni nizaad k'ehjī bee nił hodoonih t'áadoo báąh ilinígóó. Ata' halne'ígíí la' bich'i' hadeesdzh nínízingo kojī' hodiilnih 833-831-0085.

**Nepali (नेपाली):** यदि यो कागजातबारे तपाईंसँग केही प्रश्नहरू छन् भने, आफ्नै भाषामा निःशुल्क सहयोग तथा जानकारी प्राप्त गर्न पाउने हक तपाईंसँग छ। दोभाषेसँग कुरा गर्नका लागि, यहाँ कल गर्नुहोस् 833-831-0085

**Oromo (Oromifaa):** Sanadi kanaa wajiin walqabaate gaffi kamiyuu yoo qabduu tanaan, Gargaarsa argachuu fi odeeffanoo afaan ketiin kaffaltii alla argachuuf mirgaa qabdaa. Turjumaana dubaachuuf, 833-831-0085bilbilla.

**Pennsylvania Dutch (Deutsch):** Wann du Frooge iwwer selle Document hoscht, du hoscht die Recht um Hilfe un Information zu griege in dei Schprooch mitaus Koscht. Um mit en Iwwersetze zu schwetze, ruff 833-831-0085.

## Language Access Services:

**Polish (polski):** W przypadku jakichkolwiek pytań związanych z niniejszym dokumentem masz prawo do bezpłatnego uzyskania pomocy oraz informacji w swoim języku. Aby porozmawiać z tłumaczem, zadzwoń pod numer 833-831-0085.

**Portuguese (Português):** Se tiver quaisquer dúvidas acerca deste documento, tem o direito de solicitar ajuda e informações no seu idioma, sem qualquer custo. Para falar com um intérprete, ligue para 833-831-0085.

**Punjabi (ਪੰਜਾਬੀ):** ਜੇ ਤੁਹਾਡੇ ਇਸ ਦਸਤਾਵੇਜ਼ ਬਾਰੇ ਕੋਈ ਸਵਾਲ ਹੁੰਦੇ ਹਨ ਤਾਂ ਤੁਹਾਡੇ ਕੋਲ ਮੁਫਤ ਵਿੱਚ ਆਪਣੀ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਮਦਦ ਅਤੇ ਜਾਣਕਾਰੀ ਪ੍ਰਾਪਤ ਕਰਨ ਦਾ ਅਧਿਕਾਰ ਹੁੰਦਾ ਹੈ। ਇੱਕ ਦੁਭਾਸ਼ੀਏ ਨਾਲ ਗੱਲ ਕਰਨ ਲਈ, 833-831-0085 ਤੇ ਕਾਲ ਕਰੋ।

**Romanian (Română):** Dacă aveți întrebări referitoare la acest document, aveți dreptul să primiți ajutor și informații în limba dumneavoastră în mod gratuit. Pentru a vă adresa unui interpret, contactați telefonic 833-831-0085.

**Russian (Русский):** Если у вас есть какие-либо вопросы в отношении данного документа, вы имеете право на бесплатное получение помощи и информации на вашем языке. Чтобы связаться с устным переводчиком, позвоните по тел. 833-831-0085.

**Samoan (Samoa):** Afai e iai ni ou fesili e uiga i lenei tusi, e iai lou 'aia e maua se fesoasoani ma faamatalaga i lou lava gagana e aunoa ma se totoi. Ina ia talanoa i se tagata faaliliu, vili 833-831-0085.

**Serbian (Srpski):** Ukoliko imate bilo kakvih pitanja u vezi sa ovim dokumentom, imate pravo da dobijete pomoć i informacije na vašem jeziku bez ikakvih troškova. Za razgovor sa prevodiocem, pozovite 833-831-0085.

**Spanish (Español):** Si tiene preguntas acerca de este documento, tiene derecho a recibir ayuda e información en su idioma, sin costos. Para hablar con un intérprete, llame al 833-831-0085.

**Tagalog (Tagalog):** Kung mayroon kang anumang katanungan tungkol sa dokumentong ito, may karapatan kang humingi ng tulong at impormasyon sa iyong wika nang walang bayad. Makipag-usap sa isang tagapagpaliwanag, tawagan ang 833-831-0085.

**Thai (ไทย):** หากท่านมีคำถามใดๆ เกี่ยวกับเอกสารฉบับนี้ ท่านมีสิทธิ์ที่จะได้รับความช่วยเหลือและข้อมูลในภาษาของท่านโดยไม่มีค่าใช้จ่าย โดยโทร 833-831-0085 เพื่อพูดคุยกับล่าม

**Ukrainian (Українська):** якщо у вас виникають запитання з приводу цього документа, ви маєте право безкоштовно отримати допомогу й інформацію вашою рідною мовою. Щоб отримати послуги перекладача, зателефонуйте за номером: 833-831-0085.

## Language Access Services:

**Urdu (اردو):** اگر اس دستاویز کے بارے میں آپ کا کوئی سوال ہے، تو آپ کو مدد اور اپنی زبان میں مفت معلومات حاصل کرنے کا حق حاصل ہے۔ کسی مترجم سے بات کرنے کے لئے، 833-831-0085 پر کال کریں۔

**Vietnamese (Tiếng Việt):** Nếu quý vị có bất kỳ thắc mắc nào về tài liệu này, quý vị có quyền nhận sự trợ giúp và thông tin bằng ngôn ngữ của quý vị hoàn toàn miễn phí. Để trao đổi với một thông dịch viên, hãy gọi 833-831-0085.

**(Yiddish) (אידיש):** אויב איר האט שאלות וועגן דעם דאקומענט, האט איר די רעכט צו באקומען דעם אינפארמאציע אין אייער שפראך אהן קיין פרייז. צו רעדן צו אן איבערזעצער, רופט 833-831-0085.

**Yoruba (Yorùbá):** Tí o bá ní èyíkéyì ìbèrè nípa àkòsílẹ̀ yí, o ní ètọ́ láti gba ìrànwọ́ àti ìwífún ní èdè rẹ̀ lọfẹ́fẹ́. Bá wa ògbùfọ̀ kan sọrọ̀, pe 833-831-0085.

### It's important we treat you fairly

That's why we follow federal civil rights laws in our health programs and activities. We don't discriminate, exclude people, or treat them differently on the basis of race, color, national origin, sex, age or disability. For people with disabilities, we offer free aids and services. For people whose primary language isn't English, we offer free language assistance services through interpreters and other written languages. Interested in these services? Call the Member Services number on your ID card for help (TTY/TDD: 711). If you think we failed to offer these services or discriminated based on race, color, national origin, age, disability, or sex, you can file a complaint, also known as a grievance. You can file a complaint with our Compliance Coordinator in writing to Compliance Coordinator, P.O. Box 27401, Mail Drop VA2002-N160, Richmond, VA 23279. Or you can file a complaint with the U.S. Department of Health and Human Services, Office for Civil Rights at 200 Independence Avenue, SW; Room 509F, HHH Building; Washington, D.C. 20201 or by calling 1-800-368-1019 (TDD: 1- 800-537-7697) or online at <https://ocrportal.hhs.gov/ocr/portal/lobby.jsf>. Complaint forms are available at <http://www.hhs.gov/ocr/office/file/index.html>.